

ભાવનગર વિદ્યુત વિભાગમાં વિજળીકરણના કામો ના વાર્ષિકભાવો આપવા માટેનાં ભાવપત્રકની શરતો.

(૧) આ ટેન્ડર ભવિષ્યમાં તાત્કાલીક કામગીરી કરવાની જરૂર પડે ત્યારે કામ કરાવવા માટે બનાવેલ છે. જ્યારે કામની જરૂરીયાત ઉભી થશે ત્યારે નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા તાકીદે મંજૂરી આપ્યા પછી બહાલી માટે દરખાસ્ત વિભાગીય કચેરીને રજુ કરી વિભાગીય કચેરીની મંજૂરી મેળવી કામ કરાવવામાં આવશે.

(૨) રીપેરીંગ કામો તાત્કાલીક ધોરણે કરવાના રહેશે.

(૩) બાનાની રકમ તરીકે કાર્યપાલક ઇજનેરશ્રી વિદ્યુત (મા અને મ) વિભાગ ભાવનગરના નામનો રાષ્ટ્રીયકૃત કે શીડયુલ બેંકની એફ.ડી.આર.ઓછામાં ઓછી ૩૬૫ દિવસની મુદત તથા ભાવપત્રક સાથે સ્કેનીંગ કરવાનો રહેશે. તે સિવાય ભાવપત્રક રદબાતલ કરવાનો રહેશે.

(૪) સરકારશ્રીનાં વખતોવખતના નિયમો ઠેકેદારશ્રીને બંધનકર્તા રહેશે.

(૫) કોઇપણ એક કે બધા ટેન્ડર્સ કોઇપણ કારણ દર્શાવ્યા સિવાય મંજૂર કરવાનાં સક્ષમ કક્ષાએ હક્ક અબાધિત રાખવામાં આવે છે.

(૬) કોઇપણ શરતી ટેન્ડર માન્ય રાખવામાં આવશે નહીં.

(૭) લાગુ પડતા સરકારી તમામ વેરા સહીતના ભાવો ભરવાના રહેશે. બિલમા અલગ ટેક્સ,સર્વિસ ચાર્જ તથા લાગુ પડતા અન્ય વેરા ચુકવવામા આવશે નહીં. ટેન્ડરમાં દર્શાવેલ તમામ આઇટમોના ભાવો GST વગરના હોય બિલમાં GST અલગથી ચુકવામાં આવશે. સરકારશ્રી દ્વારા ભવિષ્યમા GST તથા અન્ય ટેક્ષોના નિયમોમા કોઇપણ બદલાવ થશે તો તેને આ ટેન્ડરમા લાગુ કરવામા આવશે.

(૮) આ કામગીરી દરમ્યાન સરકારી/ખાનગી ઇમારત કે ઇલેક્ટ્રીકલ માલસામાન કે કોઇ તોડફોડ નુકશાન કે આકસ્મીક આગ (જેવી કે શોટ સર્કિટ) કુદરતી આફત અકસ્માતથી કોઇપણ નુકશાન થાય તો તે અંગેની સઘળી જવાબદારી કામ રાખનાર ઠેકેદારશ્રીની રહેશે અને આ અંગે વીમો વિગેરે ઉતારવાનો થતો હોય તો તે ઠેકેદાર પોતાનાં ખર્ચે લેવાનો રહેશે. આ કામ માટે કામ આપનાર ખાતાની જવાબદારી રહેશે નહીં.

(૯) આ કામગીરી માટે ઇજારદારે લેબર (રેગ્યુલેશન એન્ડ એબોલીશન) એક્ટ-૧૯૭૦ તથા તે હેઠળ-૧૯૭૨ નાં ગુજરાત નિયમોની જોગવાઈઓ તથા કામદાર વળતર અધિનિયમ -૧૯૨૩ તથા તે હેઠળના નિયમોની જોગવાઈઓ અનુસાર ઠેકેદારે રોકેલ મજૂરોનાં કાયદેસરના હિતોની રક્ષા કરવાની તેમજ પ્રસ્તુત કાયદા અને નિયમો હેઠળ રોકાયેલ સુવિધા/સગવડો ઉપલબ્ધ કરવાનો પ્રાથમિક અને વૈધાનિકજવાબદારી મજૂરી કામે રાખનાર જે તે ઇજારદારશ્રીની રહેશે. અને આ કામગીરી દરમ્યાન કામદારોનેથતાં અકસ્માતથી શારીરીક ઇજા થાય તો તે અંગેની સઘળી જવાબદારી વળતર સહિતનઇજારદારશ્રીની રહેશે.

(૧૦) ટેન્ડર ભરનાર આસામી દ્વારા ખોટી માહિતી આપવાનું કે ખોટા પ્રમાણપત્ર, દસ્તાવેજ રજુ કર્યાનું ધ્યાને આવશે તો તે ઇજારદાર માટે ગેરલાયક ઠરશે અને તેની બાનાની રકમ જપ્ત કરવામાં આવશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

- (૧૧) મંજૂર થયેલ ભાવોની સમયમર્યાદા ૧૨ (બાર મહિના) રહેશે અને જરૂર પડ્યે સક્ષમ કક્ષાએથી તેને મંજૂરી અર્થે લંબાવવામાં આવશે.
- (૧૨) ઉપરોક્ત તમામ શરતો ઇજારદારશ્રીઓને બંધનકર્તા રહેશે અને તેના નિર્ણય અંગે સક્ષમ અધિકારીનો અબાધિત અધિકાર રહેશે.
- (૧૩) ઉપરોક્ત તમામ શરતો અમોએ વંચાણે લીધેલ છે અને બધી શરતોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તેની બાહેધરી આપીએ છીએ.
- (૧૪) સરકારશ્રીના નિયમોનુસાર ગ્રાન્ટ ઉપલબ્ધ થયેથી બીલનું ચુકવણું કરવામાં આવશે. જે બાબતે ઇજારદારશ્રી ની કોઈ ફરીયાદ ધ્યાને લેવામાં આવશે નહીં.
- (૧૫) સદર ટેન્ડરમાં એજન્સીઓએ ભરેલા ભાવ પૈકી જે એજન્સીના ભાવ સૌથી નીચા એટલે કે L1 તરીકે આવશે તે ભાવે કામ કરવા બાકીની તમામ એજન્સીએ સહમતી આપવાની રહેશે. જે ત્યારબાદ સહમતી મળેલ એજન્સીઓની વાર્ષિક ભાવની પેનલમાં સમાવેશ કરવામાં આવશે.
- (૧૬) ઇજારદારે કરેલ કામગીરી દરમિયાન નીકળેલ ડીસમેન્ટલ મટીરીયલ્સ એજન્સીએ રાખવાનો રહેશે. ડીસમેન્ટલ મટીરીયલ્સનાં પણ ઓનલાઇન ભાવો ભરવાનાં રહેશે. અને સૌથી વધુ ભરેલા ભાવ એટલે કે H1 ભાવે દરેક ઇજારદારશ્રી એ ડીસમેન્ટલનાં ભાવની સહમતી આપવાની રહેશે. નિર્ધારિત કરેલ રકમ ચુકવવાપાત્ર બીલની રકમમાંથી વસુલ કરવામાં આવશે.
- ડીસમેન્ટલના ભાવ એનેક્સર-એ માં ભરીને ફરજિયાત ડોક્યુમેન્ટ સાથે અપલોડ કરવાનું રહેશે.
- (૧૭) મરામતની કામગીરી માટે ટેન્ડરમાં સમાવિષ્ટ આઇટેમોનો ભાવ હયાત જૂનું વાયરીંગ, સ્વીચગીયર્સ, કેબલ્સ, ફીટીંગ્સ, ફેન, એસેસરીઝ તથા વિદ્યુતની આઇટેમો વગેરે કાઢીને નવી આઇટેમો લગાવવાનો ભાવ ગણવાનો રહેશે તથા જૂના મલસામાનની સરકારશ્રીના નોર્મ મુજબ ડીસમેન્ટલ રેટ નક્કી કરવામાં આવશે તેનો બિલમાંથી કપાત કરવામાં આવશે.
- (૧૮) વાર્ષિક ભાવની પેનલમાં સમાવેશ થયેલ એજન્સી પૈકી કોઈપણ એજન્સી પાસેથી સંબંધિત ના.કા.ઇ દ્વારા જરૂર પડ્યે કામગીરી કરવવામાં આવશે. જે માટે વાર્ષિક ભાવની પેનલ પૈકીની બાકીની એજન્સી કામગીરી નહીં મળવા બાબતે કોઈ દાવા રજૂ કરી શકશે નહીં.
- (૧૯) ટેન્ડરમાં સમાવેશ થયેલ આઇટેમો માત્ર વાર્ષિક ભાવ નક્કી કરવા માટે છે, સ્થળ પરની જરૂરીયાત અનુસાર ના.કા.ઇ.શ્રી દ્વારા ટેન્ડરની કોઈ એક અથવા એકથી વધુ આઇટેમની કામગીરી ઇજારદાર પાસે કરાવામાં આવશે. તે સમયે ઇજારદારશ્રીએ ટેન્ડર નિયમ મુજબ તે કામગીરી પુર્ણ કરવાની રહેશે અને આ માટે તે તેના કહેવાતા નફા કે નુકસાનના દાવા કરી શકશે નહીં. (અને ઇજારદારશ્રી દ્વારા કરેલી કામગીરીમાં થયેલા નફા કે નુકસાનના કોઈ દાવા કરી શકશે નહીં)
- (૨૦) સદર ટેન્ડરમાં, ઠેકેદારશ્રીએ તમામ આઇટેમોના ભાવોનો જરૂરી અભ્યાસ કરી ટેન્ડરના ભાવો ભરવાના રહેશે. ઠેકેદારશ્રી એ ભરેલા ભાવ અસામાન્ય જણાશે ત્યારે ઠેકેદાર દ્વારા ટેન્ડરના ભાવોનું પૃથ્થકરણ માંગવામાં આવશે જે વ્યાજબી નહીં જણાય તો તે ઠેકેદારશ્રીનું ટેન્ડર રદ કરી વાર્ષિક ભાવની યાદી તૈયાર કરવામાં આવશે. તેમજ આગળ ઠેકેદારશ્રીને અસમાન્ય ભાવો રજૂ કરવા બદલ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

(૨૧) એજન્સીએ જે તે ઇન્યાર્જ સેક્શન ઓફિસરના સંપર્કમાં રહી સેક્શન ઓફિસરની ટેલીફોનિક મેસેજ/ઇ-મેઇલ/વોટ્સઅપ્સ / પત્રથી સૂચના મળ્યે જે તે કામગીરી તાત્કાલીક શરૂ કરી પૂર્ણ કરવાની રહેશે આ માટે એજન્સીએ કરારખત સમયે ટેલીફોનિક / મોબાઇલ/ વોટ્સઅપ્સ નંબર જે ૨૪ કલાક ચાલુ સ્થિતિમાં હોય તે આપવાનો રહેશે જો તે આમ કરવામાં નિષ્ફળ જશે તો કરારખતના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ માટે એજન્સીને કોઈ પ્રી-નોટિસ આપવામાં આવશે નહીં તેમજ આ બાબતે સમયસર કામ ન પૂરું થયાની દલીલો સ્વીકારવામાં આવશે નહીં.

(૨૨) વાર્ષિક ભાવની પેનલ માં મંજૂર થયેલ એજન્સીઓ માંથી જ્યારે કોઈ એજન્સી ની કામગીરી ની ઝડપ અપેક્ષીત નહીં હોય ત્યારે જે તે સંબંધીત અધિકારી ની કામગીરી પૂર્ણ કરવાને લગત પાઠવેલ મહત્તમ બે

નોટીસ(કોઈપણ માધ્યમ દ્વારા) ને આધારે સીધુજ તે એજન્સી ની સીક્યોરીટી ડીપોઝીટ ઝપ્ત કરી તેને વાર્ષિક ભાવની પેનલ ની યાદી માથી બહાર મુકવામાં આવશે. તેમજ તેવા સંજોગો માં જરૂરીયાત પ્રમાણે નું બાકી રહેલું પુરું કામ અન્ય કોઈ એજન્સી પાસેથી કરાવવામાં આવશે આ બાબતે ઇરાજદાર કોઈ પણ પ્રકાર નો વાંધો લઈ શકશે નહીં.

(૨૩) સરકારશ્રી દ્વારા વખતોવખત પ્રવર્તમાન SOR માં કરવામાં આવતા ભાવોના સુધારાને મંજૂર થયેલ ટેન્ડરના ભાવોનાં સમપ્રમાણ માં વધારા-ઘટાડા કરવામાં આવશે તેમજ ટેન્ડરમાં સમાવિષ્ટ થયા સિવાયની અન્ય SOR ની આઇટમોની પણ જરૂર પડયે મંજૂર થયેલ ઓવરઓલ ટેન્ડરના ભાવે કામગીરી ઇજારદારશ્રીએ કરવાની રહેશે. જે માટે વધારાનું કોઈ ચુકવણું કરવામાં આવશે નહીં.

(૨૪) ટેન્ડરમાં ભાવ ભરવામાં લેનાર બધી એજન્સીઓ તરફથી રજુ કરેલ બાનાની રકમ એક વર્ષ પૂર્ણ થયેથી જે સમય સુધી ભાવોની મંજૂરી લંબાવવામાં આવે ત્યાં સુધી જમાં રાખવામાં આવશે.

(૨૫) આ ટેન્ડરનાં મંજૂર થયેલ ભાવો પ્રમાણે આ વિભાગનાં કાર્યક્ષેત્રનાં તમામ જિલ્લાઓમાં કામગીરી કરવાની રહેશે.

(૨૬) અનામતની રકમ દરેક બીલમાંથી સરકારશ્રી નાં પ્રવર્તમાન નિયમોનુસાર ૫% કાપવામાં આવશે. અને તે ડીફેક્ટ લાયાબીલીટીનો સમય પૂર્ણ થયા બાદ છુટી કરવામાં આવશે.

ઇજારદારની સહિ

કાર્યપાલક ઇજનેર
વિદ્યુત (મા અને મ) વિભાગ
ભાવનગર.